



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૮/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

સી.આર.પી.સી.કલમ ૮૨ મુજબ

આરોપી એ કોર્ટ માં હાજર થવાનું ફરમાન :

સમાચાર યાદી નં.૧૩૮૯/૧૯

ખોખરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૩ ઇપીકો કલમ ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪(ખ), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના સેસન્સ કેસ નં.૧૦/૨૦૧૫ ના આરોપી હાર્દિક ઉર્ફે હાર્દિક મોદી સ/ઓ નરેન્દ્રભાઈ શુક્લ (રહે.૮/૫૭ ગુ.હા.બોર્ડ, સર્વોદયનગર ખોખરા અમદાવાદ શહેર) નાએ ઉપરોક્ત ગુનાના કામે ફરિયાદનો જવાબ આપવા સારૂ નામદાર જજ શ્રી ટી.વી.પી. આહુજા સાહેબ, અધિકસત્ર ન્યાયધીશ, કોર્ટ નં.૨૪, સિટી સિવિલ અને સેસન્સ કોર્ટ, લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ શહેર સમક્ષ તા.૧૩/૦૮/૨૦૧૯ ના રોજ હાજર રહેવા ફરમાન કરવામાં આવે છે.

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૯૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૩ કેસ કરી, ૪૬ વ્યક્તિઓને ઝડપી, ૨૭૫ લીટર દેશી દારૂ, ૭૭ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૧ રિક્ષા અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૧૦ કેસ કરી, ૫૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૧૧,૧૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૯૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ હેઠળ ૦૩ વ્યક્તિઓની અને પાસા મુજબ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૩૯૨/૧૯

આનંદનગર : મુકેશભાઈ બાબુલાલ ચૌરડીયા (ઉ.વ.૪૪)(રહે.સેપલ ગારનેટ શેલ પેટ્રોલ પંપ સામે, પ્રહલાદનગર આદનગર) એ તા.૧૭/૦૮/૨૦૧૯ ના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે જુન/૨૦૧૬ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન પ્રહલાદનગર શેલ પેટ્રોલ પંપ સામે, સેપલ ગારનેટ અને ગાંધીનગર કલોલ ખાત્રજ કમલદીપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, લક્ષ પોલિટેક્સ પ્રા.લી.કંપની ખાતે આરોપી (૧)કૃષ્ણકાંત ભીમસેન ગોયલ (રહે.પુરષોત્તમ બંગ્લોઝ ગુરુદ્વારા પાછળ એસ.જી. હાઇવે)(લક્ષ પોલિટેક્સ પ્રા.લી.કંપની ડિરેક્ટર) (૨) બેંક ફાઇનાન્સની લોન મંજૂર કરનાર અધિકારી/કર્મચારી અને (૩)પવનકુમાર વિજયકુમાર નામની પેઢીના અધિકૃત અધિકારી/કર્મચારી નાઓએ ભેગામળી મુકેશભાઈ તથા તેમની પત્ની ની જાણ બહાર તેમના દસ્તાવેજી પુરાવાનો દૂરપયોગ કરી, મુકેશભાઈ અને તેમની પત્ની ની ખોટી સહીઓ કરી, તેમના નામે જુદી-જુદી બેંક અને ફાઇનાન્સ કંપનીમાંથી કુલ રૂપિયા ૪,૫૦,૦૦,૦૦૦/- ની બીઝનેશ લોન મેળવી મુકેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.આર.ઝરૂ ચલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૧૩૯૩/૧૯

પાલડી : અતુલભાઈ બાબુભાઈ શાહ (ઉ.વ.૬૦)(રહે.ભગવાનનગર નો ટેકરો નિરવ ફ્લેટ સામે વિશ્વકુંજ ચાર રસ્તા પાલડી) એ તા.૧૭/૦૮/૨૦૧૯ નારોજ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૪/૦૬/૨૦૧૯ બપોરના ૨/૦૦ થી તા.૦૬/૦૭/૨૦૧૯ સવાર ૮/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના બીજા માળે આવેલ લોખંડના સળીયાની સ્લાઈડરવાળી જાળીનું લોક તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોનાની ડાયમંડવાળી વીંટી તથા ચાંદીની લગડીઓ મળી કુલ કિંમત રૂપિયા ૧,૯૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.સિંઘી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૩૯૪/૧૯

દરીયાપુર : પ્રહલાદરાય રઘુનાથરાય અગ્રવાલ(ઉ.વ.૭૧)(રહે.રવિ એવન્યુ ઘોડાકેમ્પ રોડ શાહીબાગ) એ તા.૧૭/૦૮/૨૦૧૯ નારોજ દરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૦૮/૨૦૧૯ સાંજના ૬/૩૦ થી ૬/૪૦ વાગ્યા દરમ્યાન લુણાસાવાડ ત્રણ બતી રાણીસતીમાં ના મંદિરમાં રાખેલ ચાંદીની ચરણ પાદુકા કિંમત રૂપિયા ૨૮,૦૦૦/- કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એ.પાટીલ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૩૯૫/૧૯

બાપુનગર : હિમાંશુભાઈ કરશનભાઈ નાઇ (ઉ.વ.૧૮)(રહે.અભીનવ ફ્લેટ ઈન્ડીયા કોલોની બાપુનગર) એ અગમ્ય કારણસર તા.૧૭/૦૮/૧૯ સાંજના ૭/૦૦ થી ૭/૧૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે બેડરૂમના સીલીંગ ફ્રેન સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી આર.જી.રાઓલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.